

- 1) આર્થિક સમસ્યાઓનો ઉદભવ માટે જવાબદાર પરિબલ કયું છે ? --સાધનોની અછત સાધનો ના વૈકલ્પિક ઉપયોગ અને અમર્યાદિત જરૂરિયાતો
- 2) મૂડીવાદમાં મૂળભૂત આર્થિક સમસ્યાઓના ઉકેલની પદ્ધતિ કઈ હોય છે ? - ભાવતંત્ર
- 3) મિશ્ર અર્થતંત્ર માં મૂળભૂત આર્થિક સમસ્યાઓના ઉકેલની પદ્ધતિ કઈ છે? -ભાવતંત્ર અને કેન્દ્રીય આયોજન બંને
- 4) સમાજવાદી પદ્ધતિ માં મૂળભૂત આર્થિક સમસ્યાઓના ઉકેલની પદ્ધતિ કઈ છે? - કેન્દ્રીય આયોજન
- 5) અર્થશાસ્ત્ર ની કઈ શાખા માં ભાવ તંત્ર દ્વારા સાધન ફાળવણીનો અભ્યાસ થાય છે? - એકમ લક્ષી અર્થશાસ્ત્ર
- 6) ભાવતંત્ર અદ્ય હાથની જેમ સમસ્યાઓ ઉકેલે છે આ માન્યતા કોની છે? --એડમ સ્મિથ
- 7) બજારમાં કિંમત નક્કી કરનાર પરિબલો કયા કયા છે? - માંગ અને પુરવઠો
- 8) માંગ અને પુરવઠો બે સરખા થાય એ પરિસ્થિતિ ને શું કહેવાય? - સમતુલા
- 9) પુરવઠો સ્થિર રહે અને માંગમાં વધારો થાય તો કિંમત ઉપર કેવી અસર થાય છે? - કિંમતો વધે છે
- 10) માંગ સ્થિર રહે અને પુરવઠા માં ઘટાડો થાય તો કિંમત ઉપર કેવી અસર થાય છે? - કિંમતો તો વધે છે
- 11) માંગ અને પુરવઠો બંને માં વધારો થાય તો કિંમત ઉપર શું અસર થશે ?- કિંમત -એનીએ જ રહેશે કોઈ જ અસર થશે નહીં
- 12) ભાવ તંત્ર કઈ પ્રકારની પદ્ધતિ માટે મહત્વનું છે - મૂડીવાદી પદ્ધતિ
- 13) કિંમત માં ફેરફાર થવાથી માંગમાં ફેરફાર થાય તેને શું કહેવાય ? -વિસ્તરણ - સંકોચન
- 14) કિંમત સિવાયના અન્ય પરિબલોમાં ફેરફાર થવાથી માંગમાં થતા ફેરફારને શું કહેવાય?-. માંગમાં વધારો - ઘટાડો
- 15) ગિફ્ટ કોયડો કઈ વસ્તુઓ સાથે સંકળાયેલ છે? - હલકા પ્રકારની વસ્તુઓ
- 16) ગિફ્ટ કોયડો કયા અર્થશાસ્ત્રી એ આપેલો છે? - રોબર્ટ ગિફ્ટ
- 17) ભવિષ્યમાં ભાવ વધવાની શક્યતાથી વર્તમાનમાં માંગમાં કેવા પરિવર્તન થાય છે? - માંગ વધે છે
- 18) ભવિષ્યમાં ભાવ ઘટવાની શક્યતા થી માંગમાં ઘટાડો થાય તેને શું કહેવાય? -. મંદિર
- 19) વાસ્તવિક આવકમાં થતા વધારાને કારણે માંગમાં થતા ફેરફારને કઈ અસર કહેવાય? - અવેજ અસર
- 20) વસ્તુના એક વધારાના એકમમાંથી મળતા સંતોષ ને શું કહેવાય?-. સીમાંત તુષ્ટીગુણ
- 21) ઘટતા સીમાંત તુષ્ટીગુણ ના નિયમ ની સૌપ્રથમ રજૂઆત કોણે કરી છે?-. 1854 માં એચ.એચ.ગોસેન

- 22) ઘટતા સીમાંત તુષ્ટીગુણ નો સિદ્ધાંત બીજા કયા નામથી પણ ઓળખાય છે? -. ગોસેન નો પ્રથમ નિયમ
- 23) ઘટતા સીમાંત તુષ્ટીગુણ ના નિયમ ની વૈજ્ઞાનિક સમજૂતી કોણે આપેલી છે?-. પ્રો. માશૈલે
- 24) સીમાંત તુષ્ટીગુણ શૂન્ય હોય તો કુલ તુષ્ટીગુણ કેવો હોય છે? - મહત્તમ
- 25) કુલ તુષ્ટીગુણ ઘટે ત્યારે સીમાંત તુષ્ટીગુણ કેવો બને છે? - નકારાત્મક
- 26) કુલ તુષ્ટીગુણ વધતો જાય તે વખતે સીમાંત તુષ્ટીગુણ વલણ કેવું હોય છે? - સીમાંત તુષ્ટીગુણ ઘટતો જાય છે
- 27) ગ્રાહકના અધિક સંતોષ નો ખ્યાલ કોણે આપ્યો? પ્રો. માશૈલે
- 28) પ્રો. માશૈલે અધિક સંતોષ નો ખ્યાલ ક્યારે આપ્યો? - 1879
- 29) ગ્રાહકના અધિક સંતોષ નું સૂત્ર આપો - અધિક સંતોષ = કિંમત ચૂકવવાની તૈયારી - વાસ્તવમાં ચુકવેલી કિંમત
- 30) એક સરખો સંતોષ આપતા બે વસ્તુ ના જુદા જુદા સંયોજનોને જોડતી રેખા ને શું કહેવાય? - તટસ્થ રેખા
- 31) તટસ્થ રેખા નો ઢાળ કેવો હોય છે? -. ડાબી બાજુ ઉપર થી જમણી બાજુ નીચે તરફ જતી ઋણ ઢાળવાળી રેખા
- 32) તટસ્થ રેખા બીજા કયા નામથી ઓળખાય છે? - સમતુલ્પ્તિ રેખા
- 33) તટસ્થ રેખા નો ખ્યાલ કયા અર્થશાસ્ત્રી એ આપેલો છે? - હિક્સ અને એલન
- 34) સીધી ઋણ ઢાળવાળી રેખા ને શું કહેવામાં આવે છે - તક રેખા
- 35) તક રેખા ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? -. કિંમત રેખા અને બજેટ રેખા
- 36) તક રેખા નો ઢાળ કેવો હોય છે? - ઋણ ઢાળ વાળી સીધી રેખા
- 37) અવેજ અસરમાંથી કઈ અસર બાદ કરતા નિર્ભેળ અવેજ અસર પ્રાપ્ત થાય છે? -. આવક અસર
- 38) કુલ આવક નું સૂત્ર આપો. કુલ આવક = વેચાણ ના એકમો \times વસ્તુની કિંમત
- 39) સરેરાશ આવક નું સૂત્ર આપો. સરેરાશ આવક = કુલ આવક. / કુલ વેચાણ
- 40) પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વસ્તુઓ કેવા પ્રકારની હોય છે? -. સમાનગુણી વસ્તુઓના એકમ
- 41) ઈજારાયુક્ત હરીફાઈ માં વસ્તુઓ કેવા પ્રકારની હોય છે? - વિવિધ પ્રકારની
- 42) બધા ખર્ચા કયા ગાળામાં પરિવર્તનશીલ હોય છે?-. લાંબે ગાળે
- 43) કુલ સ્થિર ખર્ચ રેખા કેવા ઢાળવાળી હોય છે? $0 < x$ ધરીને સમાંતર સીધી રેખા
- 44) કુલ અસ્થિર ખર્ચ રેખા કેવા ઢાળવાળી હોય છે. -. ધન ઢાળવાળી
- 45) સી.ખર્ચે. = સ.ખર્ચે થાય ત્યારે કયો ખર્ચ લઘુત્તમ હોય છે? - સરેરાશ ખર્ચ
- 46) સ્થિર ખર્ચ + અસ્થિર ખર્ચ. = કુલ ખર્ચ
- 47) સરેરાશ ખર્ચ ઘટે તો સીમાંત ખર્ચ નું વલણ કેવા પ્રકારનું હોય છે? -. સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચ થી પણ ઓછો હોય છે

- 48) સરેરાશ ખર્ચ વધે તો સીમાંત ખર્ચ નું વલણ કેવા પ્રકારનું હોય છે? -. સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચ થી વધારે હોય છે
- 49) જ્યાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ એક સરખા થાય છે ત્યાં સરેરાશ ખર્ચ કેવો હોય છે? -. લઘુત્તમ
- 50) કાયમી સ્ટાફનું વેતન એ કયા ખર્ચમાં આવી શકીએ – સ્થિર ખર્ચ
- 51) ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કયો ખર્ચ શૂન્ય હોય છે. -. અસ્થિર ખર્ચ
- 52) ઉત્પાદન વધવાથી કયો ખર્ચ વધે છે? અસ્થિર ખર્ચ
- 53) કયા પ્રકારના બજારમાં વસ્તુઓ સમાનગુણી હોય છે - પૂર્ણહરીફાઈવાળા બજારમાં
- 54) સરેરાશ રેખા નો ઢાળ કેવો હોય છે? - U આકારની
- 55) આવક અસર કઈ રેખા દ્વારા દર્શાવવામાં આવે છે? -. આવક વપરાશ રેખા
- 56) હલકી વસ્તુઓની આવક વપરાશ રેખા કેવા પ્રકારની હોય છે - ઉલટા સી આકાર ની
- 57) કિંમત અસર કઈ રેખા દ્વારા દર્શાવવામાં આવે છે? – કિંમત ઉપભોગ રેખા
- 58) માંગ ના નિયમ મુજબ કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ હોય છે? - વ્યસ્ત સંબંધ
- 59) જો બે વસ્તુઓ એકબીજાની સંપૂર્ણ પૂરક હોય તો રેખા નો ઢાળ કેવો હોય છે? કાટખુણા આકારની અથવા L આકાર ની
- 60) જો બે વસ્તુઓ એકબીજાની સંપૂર્ણ અવેજીની હોય તો રેખા નો ઢાળ કેવો હોય છે?-. સીધી ઋણ વાળી રેખા